

COVID-19 રસીકરણ અહેવાલ મેળવવો



Gujarati

તમારા COVID-19 રસીકરણનો અહેવાલ કેવી રીતે મેળવવો

તમે રસી લઈ લો પછી, તમારા COVID-19 રસીકરણનો પુરાવો તમારા **immunisation history statement** (રસીકરણ ઇતિહાસ દાખલો)માં નોંધવામાં આવશે.

એકવાર તમે તમામ જરૂરી ડોઝ લઈ લો પછી, તમે તમારું **COVID-19 digital certificate** (ડિજિટલ પ્રમાણપત્ર) પણ મેળવી શકશો.

તમે તમારા COVID-19 રસીકરણનો પુરાવો નીચેની રીતે મેળવી શકશો:

- **Medicare** (મેડીકેર) ઓનલાઇન એકાઉન્ટ
- **Express Plus Medicare app** (એક્સપ્રેસ પ્લસ મેડીકેર) એપ
- **My Health Record** (માય હેલ્થ રેકોર્ડ)
- **Individual Healthcare Identifiers Service** (ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ આઇડેન્ટીફાયર) સેવા
- **Australian Immunisation Register** (ઓસ્ટ્રેલીયન ઇમ્યુનાઇઝેશન રજીસ્ટર)



Medicare ઓનલાઇન એકાઉન્ટ

1. તમારા **myGov** (માય ગવ) ખાતામાં (my.gov.au) સાઇન ઇન કરો અને **Medicare** પસંદ કરો
2. **Immunisation history** (રસીકરણ ઇતિહાસ) વિભાગમાંથી, **View immunisation history** (રસીકરણ ઇતિહાસ જુઓ) પસંદ કરો
3. તમારું નામ પસંદ કરો
4. **View immunisation history statement (PDF)**(રસીકરણ ઇતિહાસનો દાખલો) પર અથવા **View COVID-19 digital certificate (PDF)** (COVID-19 ડિજિટલ પ્રમાણપત્ર જુઓ) પર ક્લિક કરો.

Express Plus Medicare એપ

1. એપ ખોલો અને સાઇન ઇન કરો
2. **Services** (સેવાઓ) વિભાગમાંથી, **Immunisation history** (રસીકરણ ઇતિહાસ) પસંદ કરો
3. તમારું નામ પસંદ કરો
4. **View immunisation history statement (PDF)**(રસીકરણ ઇતિહાસ દાખલો જુઓ) પર ક્લિક કરો અથવા **View COVID-19 digital certificate (PDF)**(COVID-19 ડિજિટલ પ્રમાણપત્ર જુઓ) પર ક્લિક કરો.

My Health Record (માય હેલ્થ રેકોર્ડ)

તમે My Health Record (મારી આરોગ્ય નોંધ)માંથી તમારો COVID-19 રસીકરણનો પુરાવો મેળવી શકો છો.

જો તમારું My Health Record પહેલેથી હોય જ તો:

1. તમારા **myGov** ખાતામાં (my.gov.au) સાઇન ઇન કરો અને **My Health Record** પસંદ કરો
2. તમારો My Health Record ખોલો
3. તમારા **Record Home** (રેકોર્ડ હોમ) પેજ અથવા તમારા **Immunisations view** (રસીકરણો જુઓ) પેજ પરથી તમારા રસીકરણનો પુરાવો મેળવો (**Documents** (ડોક્યુમેન્ટ્સ), **Immunisations** (રસીકરણો) પસંદ કરો)

જો તમારો My Health Record ના હોય, પરંતુ તમારું Medicare કાર્ડ હોય તો:

1. તમારા **myGov** ખાતામાં (my.gov.au) સાઇન ઇન કરો અને તેને **My Health Record** સાથે જોડો (લીંક કરો).
2. તમારી ઓળખ સ્થાપિત કરો અને તમારો My Health Record બનાવો, ધ્યાન રાખો કે તમારા My Health Record માં રસીકરણ માહિતીનો સમાવેશ કરવાનો છે (ઇન્કલુડ ઇમ્યુનાઇઝેશન ઇન્ફોર્મેશન) (Medicare માહિતી)માં 'હા' પસંદ કરો
3. તમારો My Health Record ખોલો
4. તમારા **Record Home** (રેકોર્ડ હોમ) પેજ અથવા તમારા **Immunisations view** (રસીકરણો જુઓ) પેજ પરથી તમારા રસીકરણનો પુરાવો મેળવો

COVID-19 રસીકરણ અહેવાલ મેળવવો

Individual Healthcare Identifiers (ઇન્ડીવીડ્યુઅલ હેલ્થકેર આઇડેન્ટીફાયર) સેવા (જો તમારું Medicare કાર્ડ ન હોય તો)

જો તમારું Medicare કાર્ડ ન હોય અને તમે તમારા રસીકરણનો પુરાવો ઓનલાઇન મેળવવા માંગો છો, તો તમારે Individual Healthcare Identifier (IHI - વ્યક્તિગત આરોગ્ય ઓળખકર્તા)ની જરૂર પડશે. જો તમારી પાસે IHI ન હોય તો, તમે તે મેળવવા ઓનલાઇન અરજી કરી શકો છો.

વધુ માહિતી માટે,

www.servicesaustralia.gov.au/individuals/services/medicare/individual-healthcare-identifiers/how-get-ihl પર જાઓ.

એકવાર તમારી પાસે IHI આવી જાય પછી, તમે તમારા myGov દ્વારા તમારા રસીકરણના પુરાવા મેળવી શકો છો.

1. તમારા **myGov** ખાતામાં (my.gov.au) સાઇન ઇન કરો અને **Individual Healthcare Identifiers service (વ્યક્તિગત આરોગ્ય ઓળખકર્તા સેવા)** પસંદ કરો
2. **Services (સેવાઓ)** વિભાગમાંથી, **Immunisation History (રસીકરણ ઇતિહાસ)** પસંદ કરો
3. **View immunisation history statement (PDF)(રસીકરણ ઇતિહાસ દાખલો જુઓ)** અથવા **View COVID-19 digital certificate (PDF) (COVID-19 ડિજિટલ પ્રમાણપત્ર જુઓ)** પર ક્લિક કરો.

Australian Immunisation Register (ઓસ્ટ્રેલિયન ઇમ્યુનાઇઝેશન રજિસ્ટર)

જો તમે તમારા COVID-19 રસીકરણનો પુરાવો ઓનલાઇન ન મેળવી શકો તો,

Australian Immunisation Register (ઓસ્ટ્રેલિયાનું રસીકરણ રજિસ્ટર)ને 1800 653 809 પર સોમવારથી શુક્રવારમાં સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં ફોન કરો.

તેમને, તમારું **immunisation history statement (રસીકરણ ઇતિહાસનો દાખલો)** તમને મોકલી આપવા કહો.

તેને ટપાલમાં આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગી શકે છે.


જો તમારે દુભાષિયાની જરૂર હોય તો, **Translating and Interpreting Service (TIS)**ને 131 450 પર ફોન કરો.

ઉપયોગી લીંક્સ

તમારા રસીકરણ ઇતિહાસનો દાખલો કેવી રીતે મેળવવો તે અંગે વધુ માહિતી માટે **scan the QR code below** (નીચેનો ક્યુઆર કોડ સ્કેન) કરો.



એનએસડબ્લ્યુમાં COVID-19 રસીકરણ કાર્યક્રમ વિષે વધુ માહિતી માટે **scan the QR code below** (નીચેનો ક્યુઆર કોડ) સ્કેન કરો.



તમારા COVID-19 રસીકરણનો પુરાવો ઓનલાઇન મેળવવાનો સૌથી સરળ રસ્તો જાણવા **Scan the QR code below** (નીચેનો ક્યુઆર કોડ સ્કેન) કરો.

